



# INDIAN CHRISTIAN DAY

## યુદ્ધત્ય ઠંઠારોં તોંવહ્ડ

### ઊજવણી માટેનું માર્ગદર્શન

પ્રેમ | સેવા | ઊજવણી

**દર્શન:** લગભગ ૨૦૦૦ વર્ષોથી ભારતમાં અસ્તિત્વ રાખનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ અને સંદેશની ઊજવણી કરવી (એકરાર વાંચો)

**અધિકૃત પ્રારંભ:** ૩ જુલાઈ, ૨૦૨૧ અને ત્યારબાદ દર વર્ષે.

**કોણ ઊજવણી કરી શકે?:** ભારતીય મૂળના ઈસુ ખ્રિસ્તનાં સર્વ અનુયાયીઓ અને ઈસુ ખ્રિસ્તનાં વ્યક્તિત્વ અને સંદેશની જે સર્વ ઊજવણી કરવા ઈચ્છતા હોય તેઓ.

**ચળવળ:** ભારતમાં ઈસુ ખ્રિસ્તનાં મૂળનિવાસી ભારતીય શિષ્યો અને વિવિધ ભાષાઓ, સંસ્થાઓ અને પૂર્વભૂમિકાઓમાંના શિષ્યો.

**ઊજવણીનો વિસ્તાર અને પ્રકૃતિ:** ૩ જુલાઈનો દિવસ અથવા જો આવશ્યક હોય તો તેને સમાંતર સુયોગ્ય દિવસ સ્થાનિકસ્તરે અને વૈશ્વિકસ્તરે ભારતીય ખ્રિસ્તી દિવસ / ઈસુભક્તિ દિવસ તરીકે ઊજવણી કરી શકાય. સર્વ ઊજવણી સંભવ હોય ત્યાં સુધી સંપૂર્ણપણે બિન રાજકીય અને બિન સાંપ્રદાયિક, અને વિવિધ ભાષાઓને સમાવેશ કરનાર બાબતોને પ્રોત્સાહન આપનાર હોવી જોઈએ.

**પ્રેમનું સેવાકાર્ય:** ૩ જુલાઈ, ૨૦૨૧, શનિવારના દિવસે સમાજને આશીર્વાદિત કરવા પ્રેમ અને દયાને પ્રગટ કરનાર ઓછામાં ઓછા એક કામની પસંદગી કરો.

- **મંડળીઓ/સંગતિઓ:** એક પ્લાનિંગ ટીમની રચના કરો, જેમાં યુવાનો અને બાળકોનો સમાવેશ કરો અને મંડળીની બહાર સમાજને માટે “કેવળ એક” પ્રાયોગિક યોજનાની તૈયારી કરો.
- **વ્યક્તિઓ / પરિવારો:** એક મનના મિત્રો સાથે મળીને સમાજને માટે પ્રેમ અને દયાના “કેવળ એક” કામને પ્રગટ કરનાર કામની યોજના તૈયાર કરો.

#### ઊજવણી કરવાના કેટલાક વિચારો :

- ગરીબ પરિવારોને ભોજન સામગ્રી કે સારા કપડાંની વહેચણી કરો.
- રસ્તાઓની સફાઈ, વૃક્ષારોપણ કરો, વગેરે.
- મફત કેમ્પનું આયોજન કરો જેમ કે આંખોની તપાસ, દાંતની તપાસ, મેડીકલ, કે સાહિત્ય, વગેરે.
- ભારતીય સંગીત, નૃત્ય, પર્વોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરો.
- વિવિધ વયના લોકો માટે લલિતકળા, સંગીત, લેખન, વક્તૃત્વ વગેરે ક્ષેત્રો માટે સ્પર્ધાનું આયોજન કરો.
- નર્સિંગહોમ, હોસ્પિટલ અને જેલોમાં રહેલા લોકોની મુલાકાત કરો.

**સોશિયલ મીડિયા અને વૈશ્વિક ઊજવણી:** બેનર્સ છપાવો અને પોસ્ટર્સ બનાવો. સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં ICD/YBD હેમ અને લોગોને અપડેટ કરો. ઊજવણીના ફોટા પાડો, ફેસબુક/ ઈન્સ્ટાગ્રામમાં તેઓને શેર કરો. બ્લોગ, આર્ટિકલ્સ લખીને જનજાગૃતિ ફેલાવો.

**પૂરું પાડેલ સાહિત્ય:** મફત ડાઉનલોડ કરી શકાય એવા એકરાર, દર્શન દસ્તાવેજ અને ઊજવણી માટેના માર્ગદર્શન વેબસાઈટ પર ઉપલબ્ધ છે - [www.indianchristianday.com](http://www.indianchristianday.com)

વધુ માહિતી માટે, સંપર્ક કરો : [indianchristianday@gmail.com](mailto:indianchristianday@gmail.com)